

B.Com. Semester - 5 (CBCS) Examination
Oct/Nov - 2021 (NEW COURSE)
Indirect Tax Law - 1(Dse-3)

Time: 2:30 Hours

Marks: 70

Instructions:

1. All questions are compulsory.
2. Figures to the right indicate marks.

- પ્રશ્ન.૧ GST એટલે શું? તેના ફાયદા વર્ણવો. (૨૦)
 અથવા
 પ્રશ્ન.૧ ભારતમા GST ની જરૂરીયાતોની ચર્ચા કરી તેની બંધારણી જોગવાઈઓ વર્ણવો.
 પ્રશ્ન.૨ પુરવઠો એટલે શું? તેના કાર્યક્ષેત્રેની ચર્ચા કરો. (૨૦)
 અથવા
 પ્રશ્ન.૨ અવેજ સાથેનો પુરવઠો અને અવેજ વગરનો પુરવઠો સમજાવો.
 પ્રશ્ન.૩ ફોરવર્ડ ચાર્જ અન્વયે વસ્તુના સમયનો પુરવઠો સમજાવો. (૧૫)
 અથવા
 પ્રશ્ન.૩ ફોરવર્ડ ચાર્જ અન્વયે સેવાના સમયનો પુરવઠો સમજાવો.
 પ્રશ્ન.૪ કિમત પુરવઠા અન્વયે નીચેના પર નોંધ લખો. (૧૫)
 1. એજન્ટ
 2. અવેજ
 3. નાણું
 4. વ્યક્તિ

ENGLISH VERSION

- Q.1 What is GST? Describe its Advantages. (20)
 OR
 Q.1 Discuss need for GST in India, describe its Constitution Provision.
 Q.2 What is supply? Discuss its scope. (20)
 OR
 Q.2 What is supply with consideration and supply without consideration?
 Q.3 Explain time of supply of Goods under forward charge. (15)
 OR
 Q.3 Explain time of supply of service under reverse charge.
 Q.4 Write a note under value of supply. (Any Two) (15)
 1. Agent
 2. Considerations
 3. Money
 4. Persons
